

૧૮

પર્યુષણ અને સાંવત્સરી

જૈન તહેવારનો ઉદ્દેશ

જૈન તહેવારો સૌથી જુદ્ધ પડે છે અને તે જુદ્ધાઈ એ છે કે જૈનોનો એક પણ નાનો કે મોટા તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની લાવનામાંથી અથવા તો લય, લાલય અને વિસ્મયની લાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તો તેમાં પાછળાથી સેળબેળ થયેલી એવી લાવનાતું શાખથી સમર્થન કરવામાં આવતું હોય. નિભિત્ત તીર્થાત્રોના ડોઈ પણ કલ્યાણુકનું હોય અગર ધીજું કાઈ હોય, પણ એ નિભિત્તે ચાલતા પર્વટે તહેવારનો ઉદ્દેશ માત્ર શાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાનો જ રાખવામાં આવેલો છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા, એ બને તહેવારો પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

પર્યુષણ પર્વ : શુક્ર આષાઢિકૃ

લાંબા તહેવારામાં ખાસ છ અદ્ધાઈએ આવે છે. તેમાં પણ પર્યુષણની અદ્ધાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણ્યાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠે દિવસ લોકો જેમ બને તેમ ધર્મિધાર્યો ઓછો કરવાનો, ત્યાગ-તપ વધારવાનો, જ્ઞાન, ઉદારતા આદિ સહૃદાશો પોખવાનો અને ઐહિક, પારલોકિક કલ્યાણ થાય એવાં જ કામો કરવાનો પ્રયત્ન કરે છે. જ્યાં હેઠો તાં જૈન પરંપરામાં એક

ધાર્મિક વાતાવરણ, અપાદ ભહિનાનાં વાદળોની પેડે, ધેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના હિવસોમાં નીચેની ભાગતો સર્વત્ર નજીરે પડે છે : (૧) ધમાલ એણી કરીને બને તેટાક નિવૃત્તિ અને કુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને ભીજ ડેટલાક બેગો ઉપર એણોવતો અંકુશ. (૩) શાસ્ત્રઅવષ્ટુ અને આત્મચિંતનનું વદાણ. (૪) તપરવી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકાની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેર-બેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના.

જૈતાંખરના બને દ્વિકાઓમાં એ અહ્વાહિનું પણુસણું તરીકે જ નાણીઠું છે અને સામાન્ય રીતે બનેમાં એ અહ્વાહિનું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ હિગંબર સંપ્રદાયમાં આહે બદલે દશ હિવસો માનવામાં આવે છે અને પણુસણુંને બદલે એને દશલક્ષ્ણાણી કહેવામાં આવે છે, તથા એને સમય પણ શૈતાંખર પરંપરા કરતાં જુદ્ધ છે. શૈતાંખરના પણુસણું પૂર્ણ થયાં કે ભીજ હિવસથી જ હિગંખરાની દશલક્ષ્ણાણી શરૂ થાય છે.

[દાયિંદ્ર કાં ૧, પૃં ૩૩૫-૩૩૭]

આ અહ્વાહિયામાં આપણે ભગવાન મહાપીરની પુણ્યકથા સાંભળવા અને તેના ભર્મી ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કડોર સાધના દ્વારા જે સત્યો અનુભવ્યાં હતાં અને તેમણે પોતે જ જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકો એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યોનો સમર્થ્ય પ્રયાર કર્યો હતો, તે સત્યો સંક્ષેપમાં નણ છે :

(૧) ખીજના દુઃખને પોતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ધરવો, જેથી જીવનમાં સુખરીતતા અને વિષમતાનાં હિંસક તરવો પ્રવેશ ન પામે. (૨) પોતાની સુખસગવડનો, સમાજના હિત અર્થે, પૂર્ણ લોગ આપવો, જેથી પરિયહ અંધન ભરી લોકપકારમાં પરિણમે. (૩) સતત

જગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણું કરતા રહેલું, નેર્થી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દેખોની ચોક્કી કરી શકાય અને આત્મપુરુષાર્થીમાં એટ ન આવે.

[દાયિંદ્ર કા ૧, પૃષ્ઠ ૪૮૩-૪૮૪]

સાંવત્સરી : મહત્પર્વ

સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. ખીજાં ડાઈ પણ પરો કરતાં એ મહત્વ છે. એની મહત્ત્વ શેમાં છે એ જ સમજવાનું રહે છે.

ડાઈ પણ વ્યક્તિએ ખરી શાન્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા ડેળવવી હોય અને વ્યક્તિત્વને અંહિત ન થવા હેતાં તેનું આંતરિક અભિન્પણું સાચવી રાખવું હોય /તો એનો એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પોતાની જીવનપ્રદર્શિના દરેક ક્ષેત્રનું ભારીકીથી અવલોકન કરે. એ આન્તરિક અવલોકનનો હેતુ એ જ રહે કે તેણે કંચાં કંચાં, ડેવી ડેવી રીતે, ડાની ડાની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જેવું. જ્યારે ડાઈ માણુસ સાચા હિલથી નમ્રભણે પોતાની ભૂલ નોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટબી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે એને તેને તે સહી શકતો નથી. પોતાની ભૂલ અને ખામીનું ભાન એ માણુસને જાગતો અને વિવેક અનાવે છે. જગૃતિ અને વિવેક માણુસને ખીજ સાથે સંબંધો કેમ રાખવા, કેમ ડેળવવા એની સંજ પાડે છે. એ રીતે આન્તરિક અવલોકન માણુસની ચેતનાને ખાંહિત થતાં રોકે છે. આવું અવલોકન માત્ર ત્યાગી કે ઝડપી ભાટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને ડાઈ પણ ધંધા અને સંસ્થાના માનની માટે સંકળતાની દિલ્લીએ આવસ્યક છે, કેમ કે તે દ્વારા એ મતુષ્ય પોતાની ખામીએ નિવારતાં નિવારતાં જાંચે યડે છે અને સૌનાં દિલ્લને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્વની મુખ્ય વ્યક્તિગત બાળુ થઈ. પરંતુ એ મહત્વ સામુદ્દરિક દિલ્લીએ પણ

વિચારવાતું છે; અને હું જાણું છું ત્યાં લગી, સામુદ્દરિક દિશિએ આન્તરિક અવલોકનનું ભહીત્વ એટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કાઈ પર્વને બીજા કાઈ વર્ગો આપ્યું નથી. તેથી સમજાય છે કે સામુદ્દરિક દિશિએ આન્તરિક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કખૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા હિલથી માઝી માગવી અને સામાને માઝી આપવી એ સામાજિક સ્વાસ્થ્ય માટે પણ એટલું અગત્યતું છે.

આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દેરેક ગામ, નગર અને શહેરનો સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંદો સાથે પણ તે આવો. જ વ્યવહાર કરે. સંદોભાં માત્ર ગૃહસ્થો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંધ એટલે માત્ર એક હિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાધ્યક્ષના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દેરેક જૈન. વળી, જૈનેને જૈન પરંપરાવાળા સાથે જ જીવનું પડે છે એવું કાઈ નથી; તેમાને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તો તે નેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંધધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ સ્ત્રીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણ્ણાં છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સ્ફુર્દ્ધ-અતિસ્ફુર્દ્ધ અને અગત્ય જેવા જીવને પણ ખમાવે છે, તેના પ્રત્યે પોતે કાઈ સર્જાન-અસર્જાનપણે ભૂલ કરી હોય તો માઝી માગે છે.

ખરી રીતે આ પ્રથા પાછળની દિશિ તો બીજુ છે, અને તે એ કે જે માણુસ સ્ફુર્દ્ધ-અતિસ્ફુર્દ્ધ જીવ પ્રત્યે પણ કામળ થવા જેઠલો તૈયાર હોય તો તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું આંતર હોય, જેની સાથે કરવાશ જિની થઈ હોય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્રમા લઈ-દઈ હિલ ચોપાં કરવાં

[ફાયદિં૦ ભાગ ૧, પૃષ્ઠ ૩૫૪-૩૫૬]